

## પ્રેસનોટ

31<sup>st</sup> May 2018 World No Tobacco Day તરીકે ઉજવવામાં આવેલ જે અનુસંધાને અમદાવાદ શહેર પોલીસ વિભાગ તરફથી આ વર્ષે પોલીસ કમિશ્નરશ્રી, અમદાવાદ શહેરનાઓના માર્ગદર્શન હેઠળ ખાસ પ્રકારનાં કાર્યક્રમો આયોજન કરવામાં આવેલ. જેમાં બે તબક્કામાં પોલીસ વિભાગ તરફથી કામગીરી હાથ ધરવામાં આવેલ હતી. તમાકુના સેવનથી થતી આડઅસરો બાબતે લોકોમાં જાગૃતિ લાવવા તેમજ તમાકુ નિયંત્રણ અધિનિયમ-૨૦૦૩ ના કાયદાની ચુસ્ત અમલવારીની કામગીરી કરવામાં આવેલ હતી.

આ કામગીરીમાં અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસની મુખ્ય ભુમિકા રહેલ છે. અમદાવાદ શહેરમાં આવતા અગત્યના જાહેર સ્થળે જ્યાં વધારે તમાકુનું સેવન થતુ હોય તેવા સ્થળોએ અવેરનેશને લગત કાર્યક્રમો કરવામાં આવેલ છે. જેમ કે, કાલુપુર રેલ્વે સ્ટેશન, ગીતા મંદિર એસ.ટી. બસ સ્ટેશન, સિવિલ હોસ્પિટલ (અસારવા સિવિલ હોસ્પિટલ, સરસપુર શારદાબેન હોસ્પિટલ, સોલા સિવિલ હોસ્પિટલ સહિત), અમદાવાદ એરપોર્ટ, વસ્ત્રાપુર તળાવ, કાંકરીયા અને શૈક્ષણિક સંસ્થાઓમાં જાગૃતિ લાવવા માટે જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ. વિડીયો ક્લીપ તથા સ્ટ્રીટ પ્લે (બજાર નાટક) મારફતે તમાકુના સેવનથી સ્વાસ્થ્યને થતા નુકશાન બાબતે બતાવવામાં આવેલ છે. તેમજ ‘તમાકુ ડિઓકિશન કીટ’ તથા સાહિત્યનું પણ વિતરણ કરવામાં આવેલ. રેલ્વે સ્ટેશન ખાતે ફરજ બજવતાં ફૂલી, બસ ડ્રાઇવર, ઓટો રીક્ષા ડ્રાઇવર તથા નાગરિકો પાસેથી પ્રતિજ્ઞા લેવડાવવામાં આવેલ છે. 31<sup>st</sup> May ના છેલ્લા દિવસે કાંકરીયા ખાતે અ.મ્યુ.કો. ના સહયોગથી એક રેલીનું આયોજન કરવામા આવેલ.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ગુજરાત રાજ્ય આરોગ્ય વિભાગ, અમદાવાદ ડેન્ટલ કોલેજ, NGO અને મિડિયાના સહયોગથી અવેરનેશના કાર્યક્રમો સફળ રીતે કરવામાં આવેલ છે.

તમાકુ નિયંત્રણ અધિનિયમ-૨૦૦૩ ના કાયદાની ચુસ્ત અમલવારીના ભાગરૂપે નાગરિકોને આ કાયદાની સમજ આપવામાં આવેલ છે અને એન્ફોર્સમેન્ટની કામગીરી પણ કરવામાં આવેલ છે. જેમાં અમદાવાદ શહેર પોલીસ દ્વારા તમાકુ નિયંત્રણ અધિનિયમ-૨૦૦૩ હેઠળ ત્રણ દિવસની ડ્રાઇવ રાખેલ. જે ત્રણ દિવસના ટુંકા ગાળામાં નવ હજાર કરતાં વધારે કેસો અને રૂ.૬.૭ લાખ જેટલાં સ્થળ દંડ વસુલ કરી ઉત્તમ પરિણામ લક્ષી કામગીરી કરવામાં આવેલ

અમદાવાદ શહેરના જાહેર સ્થળો અને ખાસ કરીને શૈક્ષણિક સંસ્થાઓમાં તમાકુ અવેરનેશ અને એન્ફોર્સમેન્ટની કામગીરી પોલીસ તરફથી સતત ચાલુ રાખવામાં આવનાર છે.